

ત્વરિત જાહેરાત માટે

અશ્વેત વિરોધી જાતિવાદ પર સ્વતંત્ર બાહ્ય તૃતીય-પક્ષ સમીક્ષા થયા પછી સિટી દ્વારા તેની ભલામણોનું અમલીકરણ

બ્રેમ્પટન, ઓન્ટારિયો (05 મે 2022) – સિટી ઓફ બ્રેમ્પટને સલામત, સુલભ, જાતિવાદ વિરોધી અને સમાવેશી વાતાવરણ બનાવવા માટે પગલાં લેવાનું ચાલુ રાખ્યું છે જ્યાં કર્મચારીગણ અને નિવાસીઓ પોતાની ક્ષમતા સુધી પહોંચી શકે અને વિકસી શકે.

ગત સપ્તાહમાં, સિટીએ કાઉન્સિલ કાર્યશાળા અને કર્મચારી ટાઉન હોલનું આયોજન કર્યું જેથી [શહેરમાં અશ્વેત કર્મચારીઓના અનુભવોની સ્વતંત્ર સમીક્ષા](#) ભેદભાવપૂર્ણ અનુભવો અને પ્રથાઓના અસ્તિત્વ અને વ્યાપનું મૂલ્યાંકન કરવા માટેની પ્રક્રિયાઓ, નીતિઓ અને પ્રણાલીઓના મૂલ્યાંકનના પરિણામો સહિતની ચર્ચા થઈ શકે.

સિટીએ બાહ્ય તૃતીય પક્ષની સમીક્ષા હાથ ધરવા માટે વિલિયમ્સ HR લૉ (Williams HR Law)ને રોક્યા છે જેથી પાનખર 2020 શરૂ થયેલ કાર્યનો પ્રારંભ કરી શકાય. સમીક્ષામાં પ્રત્યક્ષ, પરોક્ષ, સૂક્ષ્મ અને પ્રણાલીગત ભેદભાવ અને અશ્વેત વિરોધી જાતિવાદની અભિવ્યક્તિઓ સંબંધિત સિટીના કર્મચારીઓના અનુભવો અને અવલોકનો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

સહભાગીઓના ઈન્ટરવ્યુ અને સંબંધિત દસ્તાવેજોમાંથી એકત્ર કરેલી માહિતીના આધારે વિલિયમ્સ HR લૉ (Williams HR Law)એ કર્મચારીના અનુભવોની આકારણીના પરિણામે અને કાર્યસ્થળે અશ્વેત વિરોધી જાતિવાદને લગતા અવલોકનોના પરિણામે 26 મુખ્ય તારણો કાઢ્યા હતાં. તારણો નીચેની શ્રેણીઓ હેઠળ નોંધવામાં આવ્યા હતા:

- વંશીય વિવિધતા
- કાર્યસ્થળનું વાતાવરણ અને સંસ્કૃતિ
- નિયુક્તિની નીતિઓ અને વ્યવહાર
- કારકિર્દીની ઉન્નતિ
- EDI તાલીમ અને નીતિઓ
- EDIની પ્રવર્તમાન પહેલ
- ઓળખ-આધારિત ડેટાનો સંગ્રહ

સિટીમાં સમાનતા, વૈવિધ્ય, સમાવેશીતા અને જાતિવાદના વિરોધને સંબોધવા માટેના આગામી પગલાઓની સામૂહિક રીતે જાણ કરવા, એક એક્શન પ્લાનના વિકાસ સાથે આગળ વધીને સિટી ઓફ બ્રમ્પટન ઇક્વિટી ઓફિસ અને હ્યુમન રિસોર્સિસ ડિવિઝન સિટીના કર્મચારીઓ તેમજ આંતરિક હિસ્સાધારકો સાથે સહયોગ સાધશે.

ઇક્વિટી ઓફિસ વિશે

પોતાના કર્મચારીઓ અને નાગરિકોની સેવા માટે ઇક્વિટી ઓફિસની મદદથી સીટી ઓફ બ્રમ્પટન મોઝેક છે ની ટર્મ ઓફ કાઉન્સિલની પ્રાથમિકતાને આગળ ધપાવી રહ્યા છે. આર્થિક સશક્તિકરણ અને અશ્વેત વિરોધી જાતિવાદ યુનિટ જ્યાં સ્થિત છે તે ડિસેમ્બર 2020માં પ્રસ્થાપિત ઇક્વિટી ઓફિસ, તમામ વ્યક્તિઓ સાથે ન્યાયપૂર્ણ અને સમાન વ્યવહારો સુનિશ્ચિત કરવા કાર્ય કરે છે અને બન્નેમાં સિટી એમજ તેના નિવાસીઓમાં સુમેળભર્યા વાતાવરણને પ્રોત્સાહન આપે છે.

જૂન 2020માં, સીટી કાઉન્સિલે અશ્વેત આફ્રિકન અને કેરિબિઅન સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક સશક્તિકરણ અને અશ્વેત વિરોધી જાતિવાદ યુનિટ બનાવતો ખરડો પસાર કર્યો છે. ત્યારથી કાઉન્સિલે અશ્વેત આફ્રિકન અને કેરિબિઅન સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક સશક્તિકરણ અને અશ્વેત વિરોધી જાતિવાદ યુનિટ અને ઇક્વિટી ઓફિસના એકીકરણ અંગેનો ખરડો પસાર કર્યો જેથી સિટીની વૈવિધ્ય, સમાનતા, સમાવેશીતા અને જાતિવાદ વિરોધ માટેની સિટીની પ્રતિબદ્ધતામાં વિકાસ સાધી શકાય.

ઇક્વિટી ઓફિસ અંગેની વધુ માહિતી અહીં ઉપલબ્ધ રહેશે Brampton.ca.

સુવાક્યો

"બ્રમ્પટન પચરંગી છે અને અમે અમારા તમામ પ્રોગ્રામ્સ, સેવાઓ અને શહેરની પહેલોમાં વૈવિધ્ય, સમાનતા અને સમાવેશીતાના સંસ્કારને ઊંડે સુધી ઉતારવું ચાલું રાખવા માટે સમર્પિત છીએ. અશ્વેત વિરોધી જાતિવાદ પર થયેલ સ્વતંત્ર તૃતીય પક્ષની સમીક્ષા દર્શાવે છે કે આપણે એક કોર્પોરેશન તરીકે હરણફાળ ભરી હોવા છતાં પણ અંતર વ્યાપી અને સંસ્થાકીય પરિવર્તન લાવવા માટે આપણે હજુ ઘણું કામ કરવાનું બાકી છે. સાથે મળીને તમામ લોકો માટેના સમાનતાભર્યા અને ન્યાયી વ્યવહારો સુનિશ્ચિત કરવા માટે આપણે અંતરાયોને દૂર કરવાનું કાર્ય ચાલુ રાખવું પડશે.

- પૅટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રમ્પટન

"બ્રમ્પટન સીટી કાઉન્સિલમાં ચુંટાયેલ પ્રથમ અશ્વેત મહિલા તરીકે મને ગર્વ છે કે સિટી ઓફ બ્રમ્પટનઆખા સમુદાય ફરતેના સ્ટાફ અને નિવાસીઓ માટે એક સલામત, સુલભ, જાતિવાદ વિરોધી અને સમાવેશી વાતાવરણ ઊભું કરવા માટેના પગલાં લઈ રહ્યા છે. આ તૃતીય-પક્ષ સમીક્ષા દર્શાવે છે કે જ્યારે સિટી વૈવિધ્ય, સમાનતા, સમાવેશીતા અને જાતિવાદને સંબોધવાનું શરૂ કર્યું છે, ત્યારે

અમારે વધુ કામ કરવાનું છે. કાઉન્સિલ અને સ્ટાફ સહયોગ કરવાનું ચાલુ રાખશે કારણ કે અમે વ્યવસ્થિતપણે થતા ભેદભાવને દૂર કરવા અને જાતિવાદ વિરોધી કાર્ય-વાતાવરણ બનાવવા માટે કામ કરવાની અમારી કાર્ય યોજના વિકસાવવા આગળ વધીશું."

- શેરમેન વિલિયમ્સ (Charmaine Williams) સીટી કાઉન્સિલર, વોર્ડ 7 અને 8, સીટી ઓફ બ્રમ્પટન

"જ્યારે સિટી ઓફ બ્રમ્પટનમાં અશ્વેત કર્મચારીઓના અનુભવોની વાત આવે ત્યારે અમે સાંભળવા, શીખવા અને નેતૃત્વ કરવા અંગે પ્રતિબદ્ધ છીએ, અને આ તૃતીય-પક્ષ સમીક્ષા અમારા કાર્યસ્થળની સંસ્કૃતિને સંબોધવા માટે એક સ્પષ્ટ માર્ગ પ્રદાન કરે છે. સંસ્થા તરીકે અમારા સેવિત સમુદાયના પ્રતિબિંબરૂપ વૈવિધ્યસભર કાર્યબળના વિકાસ માટે પગલા લેવાનું ચાલુ રાખીશું અને ધ્યાન પર રાખીશું કે તેનાથી એક સમાવેશી વાતાવરણ સર્જશે અને જ્યાં તમામ લોકો ખીલી ઉઠશે.

- પૉલ મોરિસન (Paul Morrison), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સિટી ઓફ બ્રમ્પટન

"હું સ્ટાફનો આભાર માનું છું કે જેમણે લિમિત રાખીને આ તૃતીય-પક્ષની સમીક્ષામાં યોગદાન આપ્યું અને તેમના અભિપ્રાયોનો ઉપયોગ કરીને તેમના અનુભવો વિશે સામૂહિક સત્યો જણાવ્યા જેથી સારા ભવિષ્ય માટે યથાસ્થિતિને દૂર કરવામાં મદદ મળી. અમારી ઇક્વિટી ઓફિસના માધ્યમથી અમે એક એવી સંસ્થાને વિકસાવવાનું ચાલુ રાખીશું જે જાતિવાદ વિરોધી હોય અને સિટીના કર્મચારીઓ અને અગત્યના હિસ્સાધારકો સાથે સહયોગ કરતા રહીશું જેથી સુધારા કરવાનો અવકાશ હોય એવા ક્ષેત્રો નિર્ધારિત કરી શકાય અને સુરક્ષિત, સુલભ અને સમાવેશી વાતાવરણના સર્જનમાં આગળ વધવા કામ કરી શકાય.

- મિશેલ બર્ન, મેનેજર, ઇક્વિટી ઓફિસ, સીટી ઓફ બ્રમ્પટન

"અશ્વેત જાતિવાદ વિરોધી નજરથી અશ્વેત કર્મચારીઓના અનુભવો પર વિશેષ ધ્યાન આપીને EDI સમીક્ષા હાથ ધરીને સીટી ઓફ બ્રમ્પટનની વર્કપ્લેસ ડાઇવર્સિટી એન્ડ ઇન્ક્લુઝન સ્ટ્રેટેજી એન્ડ વર્કપ્લાન (કાર્યસ્થળની વિવિધતા અને સમાવેશ વ્યૂહરચના અને કાર્ય યોજના)ને સમર્થન આપવા માટે અમને અવસર મળ્યો તેનું અમને ગૌરવ છે. અમારા જોડાણની શરૂઆતથી જ સિટીને અશ્વેત વિરોધી જાતિવાદ અને તેના કાર્યસ્થળમાં પ્રણાલીગત ભેદભાવ અને અસમાનતાના અન્ય સ્વરૂપો સંબોધિત કરવા માટે પોતાની પ્રતિબદ્ધતા વધારવામાં નોંધપાત્ર સહાય મળી છે, ખાસ કરીને તેમની ઇક્વિટી ઓફિસના વ્યવસ્થાપન અને કર્મચારીગણ તરફથી. જે રીતે નેતૃત્વ અને કર્મચારીગણ અમારી આ પ્રક્રિયામાં રોકાયેલ છે તે અમને આશાવાદી બનાવે છે કે સિટી આ ગતિને આગળ ધપાવવાનું ચાલુ રાખશે કારણ કે તે અન્ય પહેલો સાથે અમારી તે ભલામણોને પણ અમલમાં મૂકે છે જે તમામ કર્મચારીઓના લાભાર્થે તેમણે કાર્યસ્થળને વધુ ન્યાયપૂર્ણ, વૈવિધ્યસભર અને સમાવેશી બનાવવા નિર્ધારિત કરી હતી. અમારા સંગઠનને આ મહત્વપૂર્ણ કાર્ય સોંપવા બદલ આપનો આભાર અને અમે સિટીને શુભેચ્છા પાઠવીએ છીએ કે તેઓ તેમના EDIના સફરમાં વધુ અને વધુ પ્રગતિ કરતા રહે.

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 7,00,000 લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca

મિડિયા સંપર્ક (MEDIA CONTACT):

સીટી ઓફ બ્રમ્પટન મલ્ટિકલ્ચરલ મિડિયા

multiculturalmedia@brampton.ca